

નાણાં અને લાભો (Money and Benefits PDF)

વિપુલ પ્રમાણમાં અલગ અલગ લાભો હોય છે અને એ ભધા પર મગજ દોડાવવું ઘણું મૂઝવણભર્યું હોઈ શકે છે. ખાતરી કરો કે તમે પુષ્કળ મદદ મેળવો જ્યારે તમે લાભો માટે અરજી કરો – એ અગત્યનું છે કે તમે નાણાં અને મદદ મેળવો જેના માટે તમે હકકદાર છો. કેટલાક લાભો ‘ચકાસેલા ભાવાર્થો’ છે અને તમને પૂછવામાં આવે છે કે તમે અને તમારા કુટુંબીજનો કેટલું કમાય છે. કેટલાક એમ નથી. તેઓ ભધા અલગ અલગ છે અને માત્ર ત્યારે જ ચૂકવાશે જ્યારે તમે અરજી કરો તો પછી તમે શેની રાહ જોઈ રહ્યા છો?!

ખાતરી કરો કે તમારે બેન્ક અથવા પોસ્ટ ઓફિસ એકાઉન્ટ હોય કારણકે નાણાં મોટા ભાગે સીધે સીધા દર મહિને એમાં ચૂકવાશે.

2006 થી દરેક વ્યક્તિ જેઓ લાભો માટે અરજી કરે છે તેઓએ ઈન્ટરવ્યુ માટે હાજર થવાની જરૂર રહેશે. ચિંતા કરશો નહીં! બેનીફિટ્સ એજન્સીઓ તમારે જરૂરી નાણાં તમને મેળવી આપી તમને ખુશ રહેવા માટે મદદ કરવા હાજર છે. ખાતરી કરો કે તેઓ જાણતા હોય જો તમે અથવા તમારા કુટુંબીજનોને ઈન્ટરવ્યુ સમયે કોઈ મદદની જરૂર પડે, ઉદાહરણ તરીકે જો તમારે સહી કરવા અથવા અલગ ભાષામાં અનુવાદ કરવા કોઈ વ્યક્તિની જરૂર હોય. તમારે શેની જરૂર છે તેઓને એ કહેતા ગભરાશો નહીં!

અક્ષમતા નિર્વાહ ભથ્થુ.

આ દર મહિને ચૂકવાય છે અને તમારા કુટુંબીજનો કેટલું કમાય છે એ કારણથી બદલાતું નથી. નાણાંના બે ભાગમાં હોય છે અને તમારી જરૂરીયાત મુજબ તમે કાં તો એક અથવા બંને મેળવી શકો છો.

1. સંભાળનો ભાગ

જો તમારી અંગત સંભાળ અને રોજીંદી જીવનની કુશળતાઓ માટે તમને મદદની જરૂર હોય તો તમારી સંભાળ માટે તમને નાણાં મળવા જોઈએ. ત્રણ અલગ દરોએ તમે એ મેળવી શકો છો અને આ આધાર રાખે છે કે તમારે કેટલી મદદની જરૂર છે.

2. મોબીલીટીનો ભાગ

જો તમારે આમતેમ મદદની જરૂર હોય તો તમને મદદરૂપ થવા તમે નાણાં મેળવી શકો છો. બે સ્તરોએ તમે મદદ મેળવી શકો છો. આમાંનો ઓછો દર એ હોય છે જો તમે ચાલી શકતા હો અને તમને માર્ગદર્શન આપવા અથવા મદદ કરવા કોઈની જરૂર પડતી હોય. ઉચ્ચ દર એ છે જો તમે

ચાલી શકતા ના હો અથવા ચાલવું ઘણું મુશ્કેલ હોય. તમે ત્યારે પણ મેળવી શકો છો જો તમે ચાલી શકતા હો પરંતુ હંમેશા તમારી સાથે કોઈ વ્યક્તિની જરૂર હોય, જો તમે બહેરા અથવા અંધ હો, અથવા જો ચાલવાથી તમારી સ્થિતિ ભગડતી હોય. એનો અર્થ કે સહેલાઈથી પાર્કિંગ કરવા તમે ભૂરા બિલ્લા માટે અરજી કરી શકો છો અને તેથી તમારે રોડ ટેક્ષની ચૂકવણી કરવી પડતી નથી.

ક્રિયા:

બેનીફીટ્સ ઈન્ફોર્મેશન લાઇનને ફોન કરો. ફોન: 0800 88 22 00

સંભાળકર્તાનું ભથ્થુ

જો તમે મધ્યતમ અથવા ઉચ્ચતમ દરે DLA સંભાળ ભાગ મેળવતા હો તો તમારા કુટુંબ અથવા સંભાળકર્તાઓ પણ સંભાળકર્તાનું ભથ્થુ મેળવી શકે છે. અઠવાડિયાના 35 કલાકોથી વધુ તેઓએ તમારી સંભાળ રાખવાની જરૂર હોય છે અને અઠવાડિયાના £82 થી વધુ કમાતા હોવા ના જોઈએ. તેઓ 16 વર્ષથી વધુ ઉંમરના હોવા જ જોઈએ અને અઠવાડિયા ભર શાળા અથવા કોલેજમાં રહેતા હોવા ના જોઈએ. મૂળ સંભાળકર્તાનું ભથ્થુ અઠવાડિયાનું £45.70 છે પરંતુ તમારા કુટુંબીજનો વધુ મેળવી શકે છે.

ક્રિયા

બેનીફીટ્સ ઈન્ફોર્મેશન લાઇનને ફોન કરો. ફોન: 0800 88 22 00

સીધી ચૂકવણીઓ

સામાજિક કાર્યકર દ્વારા જો તમારું મૂલ્યાંકન મદદ મેળવવા તરીકે કરાયું હોય પરંતુ તમારી કાઉન્સિલ આ મદદ પૂરી પાડી શકતી ના હોય જે રીતે તમારે જોઈતી હોય તો તમે સીધી ચૂકવણીઓ માટે પ્રયત્ન કરી શકો અને મેળવી શકો છો. તમારી ઉંમર 16 વર્ષથી વધુ હોવી જ જોઈએ અને બેન્ક એકાઉન્ટ હોવું જ જોઈએ. નાણાંની ચૂકવણી આ એકાઉન્ટમાં કરાશે અને તમે ખાતરી કરી શકવા જ જોઈએ કે એનો ખર્ચ તમે કહ્યા મુજબ જ કરાવો છે અને મદદ સાથે તમે એ જાળવી શકો છો. ઉદાહરણ તરીકે તમારા ઘરમાં મદદરૂપ થવા તમે સહાય કાર્યકર્તા રાખી શકો છો તેથી તમે સ્વતંત્રપણે રહી શકો અથવા બહારના કામ માટે જઈ શકો. સીધી ચૂકવણીઓ તમારા અન્ય લાભો પર અસર કરતી નથી.

ક્રિયા

વધુ માહિતી માટે આ લિન્ક્સ તપાસી જુઓ:

http://www.direct.gov.uk/DisabledPeople/FinancialSupport/FinancialSupportArticles/fs/en?CONTENT_ID=10016128&chk=NHagZX

<http://www.multikulti.org.uk/>

તમારી સ્થાનિક કાઉન્સિલ અથવા સામાજિક કાર્યકરના સંપર્કમાં રહો અને તેઓ તમારા માટે ડાઈરેક્ટ પેયમેન્ટસમાંથી કોઈ સાથે વાત કરવા બેઠકની ગોઠવણ કરશે.

આવક સહાય

જો તમે અઠવાડિયાના 16 કલાકોથી ઓછા સમય માટે કામ કરતા હો અને બેન્કમાં વિપુલ નાણાં ના હોય તો તમે આવક સહાય મેળવી શકો છો. તમે અઠવાડિયાના કેટલા નાણાં મેળવો છો એ તપાસાશે અને આ કારણથી તમે વધુ અથવા ઓછી આવક સહાય મેળવશો. જો તમે આવક સહાય મેળવતા હો તો દવાખાના સુધી અને પાછા ફરવાની મુસાફરીની મદદ મેળવી શકો છો. તમે મફત દુધ અને વિટામીનો મેળવી શકો છો જો તમે સગર્ભા હો અથવા હમણાંજ પ્રસુતિ થઈ હોય.

ક્રિયા

બેનીફીટ્સ ઈન્ફોર્મેશન લાઇનને ફોન કરો. ફોન: 0800 88 22 00

રહેઠાણનો લાભ

તમારા મકાન ભાડા તરફી મદદ તમે મેળવી શકો છો. તમારા કુટુંબને કેટલી આવક મળે છે એ તપાસાશે અને તમે કેટલી મદદ મેળવો છો એની ઉપર અસર કરે છે. જો તમે અથવા તમા કુટુંબ આવક સહાય ઉપર હોય તો રહેઠાણના લાભ દ્વારા સામાન્યપણે તમારું મકાન ભાડુ ચૂકવાતું હશે.

ક્રિયા

બેનીફીટ્સ ઈન્ફોર્મેશન લાઇનને ફોન કરો. ફોન: 0800 88 22 00

કાઉન્સિલ કર લાભ

1 જો તમે પોતાનું મકાન ધરાવતા હો તો તમારે ચૂકવવાના દર કરતા ઓછા દરનો કાઉન્સિલ કર તમે મેળવી શકો છો કારણકે તમે અક્ષમ છો.
2 જો તમારું મકાન તમે ભાડે આપતા હો તો તમારા કાઉન્સિલ કરમાં તમે મદદ મેળવી શકો છો જો તમે રહેઠાણનો લાભ અથવા આવક સહાય મેળવતા હો.

ક્રિયા

તમારી સ્થાનિક કાઉન્સિલ શોધી કાઢો અને અરજી કરવા કહો.

<http://www.direct.gov.uk/DI1/Directories/LocalCouncils/fs/en>

કામચલાઉ કર કેડિટ

જો દર અઠવાડિયે તમે વધુ નાણાં કમાતા ના હો તો તમે આના માટે અરજી કરી શકો છો. તમે કેટલું કમાશો એની તપાસ કરાશે અને તમારા કરોની ચૂકવણીમાં મદદ કરવા તમે £1,600 થી વધુ મેળવી શકો છો.

ક્રિયા

તમારા સ્થાનિક જોબ સેન્ટર અથવા સામાજિક સેવાની કચેરીએ પૂછપરછ કરો. તમે ઈન્ટરનેટ પર ફોર્મ્સ પણ ભરી શકો છો:

<http://www.hmrc.gov.uk/taxcredits/downtime.htm>

ભાળ કર કેડિટ

તમારું કુટુંબ આ મેળવી શકે છે જો તમે અથવા તમારા એક ભાઈઓ અથવા બહેનો 19 વર્ષથી ઓછી ઉંમરના હોય અને શાળા અથવા કોલેજમાં હોય. તમારું કુટુંબ કેટલું કમાય છે એની તપાસ કરાશે અને આ કારણથી તેઓ વધુ અથવા ઓછા નાણાં મેળવશે.

ક્રિયા

તમારા સ્થાનિક જોબ સેન્ટર અથવા સામાજિક સેવાની કચેરીએ પૂછપરછ કરો. તમે ઈન્ટરનેટ પર ફોર્મ્સ પણ ભરી શકો છો:

<http://www.hmrc.gov.uk/taxcredits/downtime.htm>

અસમર્થતાનો લાભ

આ લોકોને મદદ કરવા છે જેઓ કામ કરવા અસમર્થ હોય. તમે એ મેળવી શકો છો જો તમે 16 થી વધુ ઉંમરના હો અને કાં તો કોલેજમાં ના હો અથવા એવા કોઈ અભ્યાસક્રમમાં ના હો જે માત્ર અક્ષમ લોકો માટે હોય. તમે કેટલા સમયથી કામ કરવા અસમર્થ છો એને આધારિત એ અલગ અલગ સ્તરો પર હોય છે અને તમે કામ કરી શકતા નથી એમ જણાવતો પત્ર તમારે તમારા ડોક્ટર પાસેથી મેળવવાની જરૂર પડશે.

ક્રિયા

બેનીફિટ્સ ઈન્કવાયરી લાઇનને ફોન કરો. ફોન: 0800 88 22 00

શિક્ષણ જાળવણીનું ભથ્થું

આનો અર્થ કે જો તમે સોળ વર્ષના હો અને શાળામાં રહેતા હો તો તમને મદદ કરવા તમે નાણાં મેળવી શકો છો. તમે અઠવાડિયાના £10 – £30 મેળવી શકો છો અને જો તમે શિક્ષણ ચાલુ રાખો તો તમે £500 સુધી બોનસ નાણાં મેળવી શકો છો. એનો ખર્ચ તમે તમારી ઈચ્છા મુજબ કરો! સારું લાગે છે? અરજી ફોર્મ માટે નીચેની લિન્ક પર અરજી કરો. તમારા વાલી

અથવા સંભાળકર્તાને એને ભરવાની જરૂર પડશે – તમારે મદદ મેળવવા તેઓ વર્ષના £30,000 થી ઓછા કમાતા હોવા જોઈએ.

ક્રિયા

<http://www.dfes.gov.uk/financialhelp/ema/index.cfm?fuseaction=home>

અન્ય કોણ મદદ કરી શકે છે?

આ યાદીનો અંત નથી.! અન્ય ગ્રાન્ટો અને લાભો તમે શોધી શકો છો.

આમતેમ ફરો

આમતેમ ફરવા માટે ટ્રિપ્સ્કોપનો (Tripscope) 0845 7585641 ઉપર સંપર્ક કરો. <http://www.tripscope.org.uk>

અક્ષમ લોકો માટે સગવડોની ગ્રાન્ટ

તમારુ ઘર બદલવા મદદ મેળવવા તપાસી જુઓ કે શું તમે અક્ષમ લોકો માટે સગવડોની ગ્રાન્ટ તમારી સ્થાનિક કાઉન્સિલમાંથી મેળવી શકો કે નહીં. આ શું છે એ વિષેની વધુ માહિતી માટે આ લિન્ક તપાસી જુઓ:

http://www.direct.gov.uk/DisabledPeople/HomeAndHousingOptions/YourHome/YourHomeArticles/fs/en?CONTENT_ID=4000642&chk=sl4nRl

કુટુંબનું ભંડોળ

કુટુંબી ભંડોળ કઠક ચૂકવણી કરવા મદદ કરી શકે છે જેની તમને ખરેખર જરૂર હોય જે અગત્યનું હોઈ શકે છે કે કેવી રીતે તમે જીવો છો જો તમે એ માટે અસમર્થ હો. <http://www.familyfund.org.uk/>

કુટુંબનો સંપર્ક કરો

હેલ્પલાઇન મેળવો અને લાભો વિષે પુષ્કળ માહિતી મેળવો. તેઓને 0808 808 3555 ઉપર ફોન કરી શકાય છે. <http://www.cafamily.org.uk>

કલ્યાણના અધિકારો

આ એ લોકો છે જેઓને મદદ કરવા અને ખાતરી કરવા તાલિમ અપાઈ છે કે તમે ભદ્રુ જ મેળવો છો જેના તમે હકકદાર છો. નાગરિક સલાહ કેન્દ્ર તેઓના અથવા જેને મદદ કરવા તાલિમ અપાઈ છે તેઓને તમારા સંપર્ક માં રાખી શકશે. “Welfare Rights” અને તમારા શહેરનું નામ સર્ચ એન્જિનમાં ટાઈપ કરો અને તેઓ તમને કહેશે કે તેઓ ક્યાં સ્થિત છે.

સાથે સાથે તમારાથી સૌથી નજીક સિટિઝન્સ એડવાઈઝ બ્યુરો પણ શોધી શકો છો: <http://www.citizensadvice.org.uk/macnn6/>